

પ્રકરણ - ૧૭

માહિતી મેળવવા માટે

નાગરિકોને ઉપલબ્ધ

સવલતોની વિગત

માહિતી મેળવવા માટે નાગરિકોને વિકસતી જાતિ કલ્યાણ ખાતા ધ્વારા ઉપલબ્ધ સેવાઓની વિગત.

લોકોને માહિતી મળી રહે તે માટે નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુ.રા., ગાંધીનગર નીચે જણાવેલ સવલતો ઉપલબ્ધ છે. વિકસતી જાતિ કલ્યાણ ખાતા ને લગતી માહિતી આ પુસ્તિકામાં પ્રકાશિત કરવામાં આવેલ છે. આ પુસ્તિકા સંદર્ભ અર્થે લોકો વિકસતી જાતિ કલ્યાણ ખાતામાંથી અને તેની જિલ્લા કચેરીએથી મેળવી શકે છે. સાથો સાથ વિભાગના નોટીસ બોર્ડ ઉપર પણ જરૂરી વિગતો લોકોની જાણકારી તથા ઉપયોગ અર્થે મુકવામાં આવેલ છે.

જો કોઈ અરજદારની નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતામાં ઉપલબ્ધ રેકર્ડનું નિરીક્ષણ કરવાની અરજી હોય તો તે માટે પણ એક અલાયદા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અરજદારે માંગણી કરેલ રેકર્ડનું નિરીક્ષણ કરવા માટે સગવડ કરવામાં આવી છે. સાથો સાથ કોઈ અરજદારને નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતાને લગતા કોઈ આપવાપાત્ર દસ્તાવેજોની નકલની જરૂરીયાત હોય તો તેની નકલ પણ નિયમોનુસાર જરૂરી ફી જમા કરાવી મેળવી શકે છે.

નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરીમાં કામગીરી માટે ઉપયોગમાં લેવાતા અધિનિયમો, નિયમોની નકલ પણ વિકસતી જાતિ કલ્યાણ ખાતુ અને તેની જિલ્લા કચેરીઓમાં ઉપલબ્ધ છે જેનો પણ જાહેર જનતા જરૂર પડ્યે ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત કોઈ અરજદારને વિકસતી જાતિ કલ્યાણ ખાતાને સંબંધિત માહિતી સહેલાઈથી તેમના રહેણાંકના સ્થળે મળી રહે તે હેતુસર નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતાની માહિતી <http://sje.gujarat.gov.in/ddcw> વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન કોઈ અગત્યની માહિતી કે જાણકારી કે જેની જનતાને જાણ કરવી પણ જરૂરી હોય તેવી માહિતી જે તે વખતે વર્તમાનપત્રોમાં જાહેર ખબર/અખબારી યાદી ધ્વારા પણ પ્રસિધ્ધ કરવાનું આયોજન છે. તેવી જ રીતે કેટલીક જાણકારીઓ સંદર્ભમાં વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકની જિલ્લા કચેરીઓ ધ્વારા શિબિર યોજીને જાહેર જનતા માટે જાણકારી પણ આપવામાં આવે છે. આ શિબિરની જાણ જનતાને પહોંચે તે માટે પણ તંત્ર ધ્વારા જરૂરી કાળજી લેવામાં આવે છે.